

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના પ્રાદેશિક કાઉન્સિલર રોવિના સેન્ટોસ (Rowena Santos) FCM બોર્ડમાં ફરીથી ચૂંટાયા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 7, 2022) – ફેડરેશન ઓફ કેનેડિયન મ્યુનિસિપાલિટીસ (FCM) દ્વારા, પોતાની વાર્ષિક સાધારણ સભામાં ઘોષણા કરવામાં આવી કે રોવિના સેન્ટોસને વર્ષ 2022 થી 2023 નાં એક-વર્ષના સમયગાળા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ફરીથી ચૂંટવામાં આવ્યા છે.

FCM વર્ષ 1901 થી કેનેડાની મ્યુનિસિપલ ગવર્નમેન્ટનો રાષ્ટ્રીય અવાજ બની રહ્યું છે. સભ્યોમાં દેશભરમાંથી 2,000 થી વધારે મ્યુનિસિપાલિટીસનો સમાવેશ થાય છે, જેઓ બધાં કેનેડિયન નાગરિકોમાંથી 90 ટકાથી વધારેનું પ્રતિનિધિત્વ કરે છે. ફેડરેશન ઓફ કેનેડિયન મ્યુનિસિપાલિટીસની વાર્ષિક કોન્ફરન્સ અને ટ્રેડ શો જૂન 2 થી 5 સુધી હાઈબ્રિડ સ્વરૂપે યોજવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષનો વિષય ટૂગેથર ફોર રિકવરી હતો, જે સુદૃઢ અને સર્વગ્રાહી રિકવરી માટેના ચાલકો તરીકે મ્યુનિસિપાલિટીસની અનિવાર્ય ભૂમિકાને પ્રબળ બનાવે છે.

આ કોન્ફરન્સે ફેડરલ ગવર્નમેન્ટ પાસેથી સહાયતા અને ભંડોળ માટે હિમાયત કરવાની અને સીટી ઓફ બ્રેમ્પટન મહત્વના મુદ્દાઓની ચર્ચા કરે તે માટેની તક પૂરી પાડી હતી, જે નીચે મુજબ છે:

- વધારે સારી ટ્રાન્ઝિટનું નિર્માણ કરવાની કટિબદ્ધતા;
- સક્રિય પરિવહન માટે માળખાગત સગવડો અને કાર્યક્રમોને અમલમાં મૂકવા કાયમી ભંડોળ;
- આબોહવામાં ફેરફારને અનુકૂલન અને સ્થિતિસ્થાપકતાને આગળ વધારવા રોકાણો; અને,
- આર્થિક વિકાસ અને રિકવરી, નોકરીઓ અને વૃદ્ધિમાં રોકાણો.

સીટીની હિમાયત પર વધુ માહિતી [સીટી ઓફ બ્રેમ્પટનની વેબસાઈટ](#) પર ઉપલબ્ધ છે.

ક્વોટ્સ (અવતરણો)

“દેશભરના મ્યુનિસિપલ આગેવાનોની ટીમ સાથે રહીને વધુ એક સમયગાળા માટે FCM બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સેવા આપવી એ સન્માનની વાત છે. FCM માં, અમે મૌલિક વિચારોને વધારે સબળ અર્થતંત્રમાં પરિવર્તિત કરવા અને લોકો માટે જીવન વધારે સારું બનાવવા ભાગીદારીઓ વધારે મજબૂત બનાવી રહ્યાં છીએ, અને હું બ્રેમ્પટનવાસીઓ માટે સૌથી મહત્વની મુખ્ય અગ્રતાઓ પર હિમાયત કરવાનું ચાલુ રાખીશ. FCM નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણી રિકવરીમાં આગળ વધવા આપણાં શહેરો અને રહેવાસીઓને જરૂરી બાબતો શોધવાનું, અને સૌ માટે કાયમી, સ્થિતિસ્થાપક અને વધારે સારા ભવિષ્યનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે.”

- રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન સીટી કાઉન્સિલર વતી, હું કાઉન્સિલર સેન્ટોસને FCM બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર વધુ એક વર્ષ માટે સેવા આપવા ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે રોવિનાની ઝુંબેશ અને કટિબદ્ધતાથી આપણી કાઉન્સિલ દ્વારા કરાતું કામ આગળ વધવાનું ચાલુ રહેશે, અને બ્રેમ્પટન અને પીલ રહેવાસીઓના અવાજો સંભળાતા હોવાની ખાતરી કરાવશે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca